GAUTAM GEMS LIMITED

(CIN: L36911GJ2014PLC078802)
REGISTERED OFFICE: 3RD FLOOR, OFFICE-301, SUMUKH SUPER COMPUND,
VASTADEVADI ROAD, SURAT-395004.

EMAIL: COMPLIANCEGGL@GMAIL.COM PH: 0261-2538046

WEBSITE: WWW.GAUTAMGEMS.COM

Date: 07-09-2024

To,
The General Manager- Listing
Corporate Relationship Department
The BSE Limited
P.J. Towers, Dalal Street,
Fort, Mumbai- 400 001

Sub: Submission of Newspaper Advertisement of 11th Annual General meeting for Financial

Year 2023-24

Ref: GAUTAM GEMS LIMITED (Scrip Code: 540936)

Dear Sir/Ma'am,

In compliance with the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of newspaper publication both in English and local language providing details and information with respect to the 11th Annual General Meeting of the Company for FY 2023-2024.

Kindly take the same on your record.

Thanking You,

Yours Faithfully,

FOR, GAUTAM GEMS LIMITED

Gautam P. Sheth Managing Director (DIN: 06748854)

વીમા દાવાની પતાવટ ફટાફટ થશેઃ 'ઈરડા'એ સમયગાળો ઘટાડયો

ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગ્રાહકો માટે સેવા વધારવાના ઉદ્દેશ્યથી વીમા કંપનીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ સર્વીસીસ માટે સમયમર્યાદા કડક બનાવી છે.

જીવન વીમામાં તપાસની જરૂર ન હોય તેવાં મૃત્યુના દાવાઓ ૧૫ દિવસમાં પતાવટ કરવા કહ્યું હતું જેમાં પહેલાં ૩૦ દિવસ લાગતાં હતાં.

મુંબઈ.તા.૬ દિવસમાં પતાવવા જોઈએ. નવી ઈન્સ્યોરન્સ રેગ્યલેટરી એન્ડ દરખાસ્તો પર સાત દિવસમાં પ્રક્રિયા પોલિસી દસ્તાવેજો જારી કરવા

મૃત્યુ વીમાના દાવાનો ૩૦ના બદલે ૧૫ દિવસમાં નિકાલ કરવો પડશે

કેશલેસ દાવાઓ ત્રણ કલાકની અંદર સંબંધિત સેવાઓ અને મૂળ પોલિસી

યુનિટ-લિંક્ડ વીમા પોલિસીમાં, થવી જોઈએ અને પખવાડિયામાં સ્વિચ અને ટોપ-અપ કલેઈમ જેવી સેવાઓ સાત દિવસમાં પૂર્ણ કરવી આવશ્યક છે. ગ્રાહકની કોરેયાદનાં કિસ્સામાં, વીમા કંપનીએ તરત જ ફરિયાદ સ્વીકારવી જોઈએ અને ૧૪ દિવસની અંદર કાર્યવાહી શરૂ કરવી જોઈએ. જો આ સમયગાળામાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો, વીમા કંપનીએ ફરિયાદીને મૂળ ફરિયાદની મૃત્યુનાં દાવાઓ માટે જેમાં કલ, જોઈએ. ફ્રી-લુક કેન્સલેશનના તેમનાં તારીખના ૧૪ દિવસની અંદર જાણ

માસ્ટર સર્ક્યુલરની મુખ્ય આઇઆરડીએઆઇએ કહ્યું હતું કે કરવી જરૂરી છે. પોલિસી લોન વિવિધ તબક્કામાં આવશ્યક માહિતી પ્રદાન કરવી અને પોલિસી વિગતો સાથે અને નોન-કેશલેસ દાવાઓ ૧૫ શરતોમાં ફેરફાર પણ સાત દિવસની ગ્રાહકને માહિતી પત્રક ફરજિયાત આપવું જોઈએ વધ્માં, વીમા કંપનીઓએ પ્રાદેશિક ભાષાઓમાં પ્રપોઝલ ફોર્મ અને સીઆઇએસ ઑફર કરવી જોઈએ અને જીવન અને દિવસનો ફ્રી-લુક પિરિયડ પણ આપવો

નિશાન પરઃ પગલા લેવા ભલામણ

ટ્રાઈએ સ્પામ અને ફ્રોડ કોલ્સને મંત્રાલયે તેમને રોકવા માટે તાત્કાલિક

ટ્રાઈએ કેમ ન લીધો નિર્ણય ? એપ્સની આઇટી મંત્રાલય હેઠળ

આવે છે. ટ્રાઈ દ્વારા આવ્યો છે. **ટ્રાઈના અધિકારીઓએ** આ અંગે કોઈ આઈટી મંત્રાલયને આવાં કોલ રોકવા માટે નિર્ણય લઈ શકાય તાત્કાલિક પગલાં લેવા નહા. કારણ ક આ એપ્સ ટ્રાઈના

પણ કહ્યું અધિકારક્ષેત્રમાં રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાં નથી. ટાઈ દ્વારા મોકલવામાં આવેલાં ટ્રાઈએ કહ્યુ હતું . ટ્રાઈ સ્પામ અને પત્રમાં તમામ માહિતી આપવામાં ફ્રોડ કોલ્સને રોકવા માટે સતત નવાં આવી છે. તે પણ સમજાવવામાં પગલાં લઈ રહ્યું છે. આ અંગે ટ્રાઈ આવ્યું છે કે આવાં કોલ કેવી રીતે દ્વારા ટેલિકોમ કંપનીઓને પણ ઓળખી શકાય. નિયમનકારોની સંયુક્ત સમિતિએ પણ આ વાત કરી છે. ટાઈના અધિકારીઓએ આવાં છે. ટેલિકોમ રેગ્યલેટરે આઈટી કોલ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ કહ્યું છે. આમાં વાસ્તવમાં ટ્રાઈનું કહેવું છે કે અત્યારે કો મ્યુનિકે શન એ પ્સના નામ આપવામાં આવ્યાં છે.

આરોપીની મુક્તિ રોકી શકે નહીં: સુપ્રીમ નવી દિલ્હી, તા. કે ભોગે જતન થવું જોઇએ. પટના તેને જામીન મંજૂર કરવામાં વિલંબ

આરોપીઓને ટાયલ વગર જેલમાં

રાખવા મુદ્દે સતત સર્જાઇ રહેલા વિવાદ

દોષિત સાબિત ન થાય ત્યાં સુધી

ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જયોર્જ

૨૦૨૪ના આદેશને ૨૬ કરીને હત્યાના

આરોપીને જામીન પર છોડવા આદેશ

આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોતાના

પહોંચે છે કે આરોપી જામીનનો હકકદાર

છે તો પછી તેને તેની મુકિત સ્થગિત

કરી શકે નહીં. સુપ્રીમે કહ્યું કે આરોપીની

મુકિતમાં વિલંબ એ તેના બંધારણીય

અધિકારનું ઉદ્ઘંઘન છે. જેમાં કલમ

૨૧ હેઠળ નાગરિકોને મૌલિક અધિકારો

આપવામાં આવ્યા છે તેનં કોઇપણ

हर्शन ओर्ना (GH2S || CIN: L36910GJ2011PLC063745

રજિસ્ટર્ડ ઓફિસ : સર્વે નંબર ૦૨૧૦૫+૨૧૦૬/૩/લવાર ની પોળ, શેખસરૈયા ચેમ્બર્સ,

મદન ગોપાલ હવેલી રોડ, માણેક ચોક અમદાવાદ-૩૮૦૦૦૧ || Contact : 07922142568

Website: www.darshanorna.co.in | E-mail: compliancingdarshan@gmail.com

૧૩મી વાર્ષિક જનરલ મીટિંગની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે દર્શન ઓર્ના લિમિટેડના સભ્યોની ૧૩મી વાર્ષિક જનરલ સભ (AGM) સોમવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સ

("VC")દ્વારા વ્યાપાર વ્યવહાર કરવા માટે યોજાવાની છે. ૧૩મી એજીએમની નોટિસમાં નિર્ધારિત

કરવામાં આવી છે, જે એજીએમ બોલાવવા માટે પ્રસારિત કરવામાં આવી રહી છે. કંપનીએ પહેલાર્થ

જ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા ૧૩મી એજીએમ

બોલાવવાની નોટિસ સાથે એવા શેરધારકોને મોકલી દીધો છે કે જેમના ઈમેલ એડ્રેસ કંપની અને

અથવા ડિપોઝિટરીઝમાં કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ

ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા પરિપત્રો અનુસાર નોંધાયેલા છે. ૧૩મી એજીએમની સૂચના સાથેન

વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.darshanoma.co.in પર અને નેશનલ સિક્યોરિટીઝ

કુંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ મુજબ કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન)

નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦, સેબીના નિયમન ૪૪ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર

રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ અને સેકેટરીયલ સ્ટાન્ડર્ડ્સ સામાન્ય મીટિંગ (°SS-2 ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેકેટરી ઓફ ઈન્ડિયા દારા જારી કરાયેલ, કંપની તેના તમામ સભ્યો

ઈલેક્ટ્રોનિક માધ્યમો (ઈ-વોટિંગ) નો ઉપયોગ કરીને એજીએમની સૂચનામાં નિર્ધારિત તમા

ઠરાવો પર પર તેમનો મત આપવા માટે સુવિધા પૂરી પાડે છે. NSDL દ્વારા પૂરી પાડવામાં આવેલ ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ. સભ્યોના મતદાન અધિકારો સોમવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪

"કટ-ઓફ તારીખ") ના રોજ કંપનીના પેઇડ અપ ઇક્વિટી શેરમાં તેમના દ્વારા રાખવામાં આવેલા

ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે, જે મુજબ વિગતો જરૂરી છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈ અને તેના હેઠળ બનાવેલા નિયમો નીચે આપેલ છેઃ

૧) બુક બંધ કરવાનો સમયગાળો ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શરૂ થશે અને ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે (બંને દિવસો સહિત);

૨) રીમોટ ઈ-વોર્ટિંગનો સમયગાળો શુક્રવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૦૯:૦૦

વાંગ્યે શરૂ થશે અને રવિવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ વાંગ્યે સમાપ્ત થશે.

૩) ઈ-વોટિંગના અધિકારો નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ સોમવાર, ૨૩મી

૪) સભ્યોને ઉપરોક્ત ઉદ્ઘેખિત સમયગાળા પછી દૂરસ્થ ઈ-વોટિંગ દ્વારા મતદાન કરવાની

પ) શેરહોલ્ડર કંપનીનો હિસ્સો મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખે શેર હોલ્ડ કર્યા પછી કંપનીના સભ્ય બને છે તેઓ તેમના મતદાન અધિકારોનો

દ્દ) જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોર્ટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ પણ એજીએમમ હાજરી આપી શકે છે / ભાગ લઈ શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવામાટે હકદાર નથી. ૭) બોર્ડે મેસર્સ નીલમ સોમાણી એન્ડ એસોસિએટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્ક્રૂટિનાઈઝર તરીકે નિમણુંક કરી છે, જેઓ વોટિંગના

૮) રિમોટ ઈ-વોટિંગને લગતી કોઈપણ પ્રશ્નો / ફરિયાદોના કિસ્સામાં તમે શેરધારકો

માટે વારવાર પૂછાતા પ્રશ્નો ('FAQs') અને મદદ વિભાગ હેઠળ www.evoting.nsdl.cor

પર ઉપલબ્ધ શેરેધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો

દર્શન ઓર્ના લિમિટેડ માટે

sd/- **રીતેશ મહેન્દ્રભાઈ શેઠ** મેનેજિંગ ડિરેકટર -DIN: 07100840

ઉપયોગ કરવા માટે એજીએમની સૂચનામાં ઉલેખિત પગલાંને અનુસરી શકે છે;

સપ્ટેમ્બર, ૨૦૨૪ છે;

મંજૂરી આપવામાં આવશે નહીં:

પરિણામો ચેરમેનને સબમિટ કરશે.

તારીખ : ૦૬-૦૯-૨૦૨૪

સ્થળ : અમદાવાદ

અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩૫૨ સંપર્ક કરો

ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે.

જામીનના હકકદાર માન્યા બાદ પણ અદાલત

પટના હાઇકોર્ટના આદેશ સામે સર્વોચ્ચ અને સુપ્રીમ કોર્ટ દ્વારા જયાં સુધી અદાલતે નિરીક્ષણ જામીનનો અધિકાર છે તે સ્પષ્ટ વલણ વ્યક્ત કર્યુ : છ મહિના અપનાવ્યા બાદ સર્વોચ્ચ અદાલતના ન્યાયમર્તિ અભય એસ. ઓકા અને બાદ જ જામીન પર છોડવાના આદેશને રદ્દ મસીહએ પટના હાઇકોર્ટને ૧૯ એપ્રિલ કર્યો : તાત્કાલીક મુક્તિ જરૂરી

ચુકાદામાં જણાવ્યું હતું કે જયારે આંશિક રીતે સ્વીકારી લીધી હતી. પરંત્ અધિકારનું ઉદ્ઘંઘન ગણાશે. અદાલત એ નિર્ણય પર કે તારણ પર

દેશમાં વિવિધ અપરાધોના હાઇકોર્ટે એક હત્યા કેસના આરોપી થયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખુદ હાઇકોર્ટ કહે છે કે અપીલ કરનાર જામીનનો હકકદાર છે અને વાસ્તવમાં

અપીલ કરનારને જામીન આપવામાં આવ્યા છે પરંતુ સાથોસાથ એ શરત જોડવામાં આવી છે કે આદેશના છ મહિના પછી જામીન પર છોડવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તેના પર આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે જયારે અદાલત ખુદ તારણ આપે છે કે આરોપી જામીનનો હકકદાર છે તો પછી તેના જામીનને સ્થગિત કરી શકે નહીં. જો જીતેન્દ્ર પાસવાનની જામીન અરજી આમ કરે તો તે આરોપીના મૌલિક

ગોતમ જેમ્સ લિમિટેડ

રિજસ્ટર્ડ ઓફિસ: ત્રીજો માળ, ઓફિસ: ૩૦૧, સુમુખ સુપર કમ્પાઉન્ડ, વસ્તા દેવડી રીડ, સુરત - 395004 || Website : www.gautamgems.com || Contact : 0261-2538046 || Email : complianceggl@gmail.com || CIN NO : L36911GJ2014PLC078802

૧૧મી વાર્ષિક જનરલ મીટિંગની નોટિસ

ખાથી નોટિસ આપવામાં આવે છે કે ગૌતમ જેમ્સ લિમિટેડના સભ્યોની ૧૧મી વાર્ષિક જનરલ સભા (AGM) સોમવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સ "VC")દ્વારા વ્યાપાર વ્યવહાર કરવા માટે યોજાવાની છે. ૧૧મી એજીએમની નોટિસમાં નિર્ધારિત કરવામાં આવી છે. જે એજીએમ બોલાવવા માટે પ્રસારિત કરવામાં આવી રહી છે. કંપનીએ પહેલાથી ૪ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા ૧૧મી એજીએમ મોલાવવાની નોટિસ સાથે એવા શેરધારકોને મોકલી દીધો છે કે જેમના ઈમેલ એડ્રેસ કંપની અને બુથવા ડિપોઝિટરીઝમાં કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને સિક્થોરિટીઝ એન્ડ એક્સર્ચેન્જ બોર્ડ ઓક ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા પરિપત્રો અનુસાર નોંધાયેલા છે. ૧૧મી એજીએમની સૂચના સાથેન વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.gautamgems.com પર અને નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે.

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ મુજબ કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦, સેબીના નિયમન ૪૪ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્લાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ અને સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ્સ સામાન્ય મીટિંગ (°SS-2° ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલે, કંપની તેના તમામ સભ્યોન ઈલેક્ટ્રોનિક માધ્યમો (ઈ-વોટિંગ) નો ઉપયોગ કરીને એજીએમની સૂચનામાં નિર્ધારિત તમામ કરાવો પર પર તેમનો મત આપવા માટે સુવિધા પૂરી પાડે છે.NSDL દ્વારા પૂરી પાડવામાં આવેલ ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ. સભ્યોના મતદાન અધિકારો સોમવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ ("કટ-ઓફ તારીખ") ના રોજ કંપનીના પેઇડ અપ ઇક્વિટી શેરમાં તેમના દ્વારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે, જે મુજબ વિગતો જરૂરી છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈ અને તેના હેઠળ બનાવેલા નિયમો નીચે આપેલ છેઃ

૧) બુકબંધ કરવાનો સમયગાળો ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શરૂ થશે અને ૩૦મી મપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે (બંને દિવસો સહિત);

૨) રીમોટ ઈ-વોટિંગનો સમયગાળો શુક્રવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૦૯:૦૦ વાંગ્યે શરૂ થશે અને રવિવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે. ૩) ઈ-વોટિંગના અધિકારો નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ સોમવાર, ૨૩મી સપ્ટેમ્બર

૪) સભ્યોને ઉપરોક્ત ઉક્ષેખિત સમયગાળા પછી દૂરસ્થ ઈ-વોટિંગ દ્વારા મતદાન કરવાની મંજૂર્ર ખાપવામાં આવશે નહીં;

૫) શેરહોલ્ડર કંપનીનો હિસ્સો મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખે શેર હોંલ્ડ કર્યા પછી કંપનીના સભ્ય બને છે તેઓ તેમના મતદાન અધિકારોનો ઉપયોગ કરવા માટે એજીએમની સૂચનામાં ઉક્ષેખિત પગલાને અનુસરી શકે છે; ૬) જે સબ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ પણ એજીએમમાં

હાંજરી આપી શકે છે / ભાગ લઈ શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવામાટે હકદાર નથી. ૭) બોર્ડે મેસર્સ નીલમ સોમાણી એન્ડ એસોસિએટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્ક્રૂટિનાઈઝર તરીકે નિમણુંક કરી છે, જેઓ વોટિંગના પરિણામો ચેરમેનને સબમિટ કરશે.

૮) રિમોટ ઈ-વોટિંગને લગતી કોઈપણ પ્રશ્નો / ફરિયાદોના કિસ્સામાં તમે શેરધારકો માટે વારંવાર પૂર્ણાતા પ્રશ્નો ('FAQs') અને મદદ વિભાગ હેઠળ www.evoling.nsdl.com પર ઉપલબ્ધ શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩

તારીખ : ૦૬-૦૯-૨૦૨૪

ગૌતમ જેમ્સ લિમિટેડ માટે sd/- ગૌતમ પ્રવિણચંદ્ર શેઠ મેનેજિંગ ડિરેકટર -DIN: 06748854

આદિનાથ એક્ઝીમ રીસોર્સીસ લિમિટેડ

CIN: L65100GJ199PLC024300;
REGI. OFFICE: 801, Astron Tower, Opp. Iskon Mandir, Nr. Casalla Tower,
Satellite, Ahmedabad - 380015. Ph. 6351738619
Email:aerlnodalofficer@gmail.com • Website: www.adinatheximresources.co ૩૦મી વાર્ષિક સામાન્ય સભા,

ઈ-વોટિંગ અને બુક ક્લોઝર માટે શેરધારકોને સૂચના

આથી સચના આપવામાં આવે છે કે કંપનીની 30મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) સોમવાર, 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ સવારે 11.00 કલાકે એજીએમ બોલાવતી તા. 09 ઓગસ્ટ. 2024 ની નોટિસ માં જણાવેલ કામકાજ કરવા વિડિયો કોન્કરન્સ (વીસી)/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા યોજવામાં આવશે . મંત્રાલય દ્વારા જારી કરાયેલ 28 ડિસેમ્બર, 2022ના પરિપત્ર અનુસાર અને આ સંદર્ભે એમસીએ દ્વારા જારી કરાયેલા અન્ય પરિપત્રો સાથે કોર્પોરેટ અફેર્સનું વાંચન (સામૂહિક રીતે તરીકે ઓળખવામાં આવે છે. "એમસીએ પરિપત્ર ") અને સેબી નો પરિપત્ર 05 જાન્યુઆરી, 2023 ના રોજ આ મંદર્ભે મેબી હારા બહાર પાડવામાં આવેલા અન્ય પરિપત્રો સાથે (સામહિક રીતે " સેબી પરિપત્રો " તરીકે ઓળખાય છે) કંપનીએ 2023-24નો વાર્ષિક અહેવાલ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા એજીએમ બોલાવવાની સૂચના સાથે માત્ર એવા સભ્યોને મોકલ્યો છે કે જેમના ઈમેલ એડ્રેસ કંપની અને/અથવા ડિપોઝિટરીઝમાં નોંધાયેલા છે. વાર્ષિક અફેવાલ સાથે એજીએમ બોલાવવાની સૂચના કંપનીની વેબસાઇટ www.adinatheximresources.com પર અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે બીએસઇ લિમિટેડ એટલે કે www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે. અને નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("એનએસડીએલ ")

ની વેબસાઇટ પર https://www.evoting.nsdl.com કંપનીઝ એક્ટ, 2013 ની કલમ 108 મુજબ કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, 2014 ના નિયમ 20 અને સેબી (LODR) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમન 44 સાથે વાંચવામાં આવે છે, કંપની તેના સભ્યોને તેમનો મત આપવા માટેની સુવિધાઓ પૂરી પાડે છે. નીચે મુજબ 'રિમોટ ઈ-વોર્ટિંગ' દ્વારા અને એજીએમ સમયે ઉપરોક્ત નોટિસમાં દર્શાવેલ તમામ કરાવો પર 'ઈ-વોટિંગ'. કંપની અધિનિયમ, 2013 અને ત્યાં બનાવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર જરૂરી વિગતો અહીં નીચે આપવામાં આવી છે:

એજીએમના ફેતુ માટે કંપનીના મંગળવાર, સપ્ટેમ્બર 24, 2024 થી સોમવાર, સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર સપ્ટેમ્બર 30, 2024 સુધી. બુક્સ બંધ રહેશે ગુરુવાર, સપ્ટેમ્બર 26, 2024 સવારે 9:00

રીમોટ ઈ-વોટિંગની શરૂઆતની તારીખ અને સમય રીમોટ ઈ-વોટિંગની સમાપ્તિની

તારીખ અને સમય

રવિવાર, 29 સપ્ટેમ્બર, 2024 સાંજે 5:00 વાગ્યે અને તે પછી રિમોટ ઈ-વોર્ટિંગને મંજૂરી આપવામાં આવશે નહીં.

રિમોટ ઈ-વોટિંગના અધિકારો નક્કી સોમવાર, સપ્ટેમ્બર 23, 2024 કરવા માટેની કટ-ઓફ તારીખ

જે વ્યક્તિઓ કંપની દ્વારા એજીએમ ની નોટિસ ઈમેલ કર્યા પછી કંપનીના સભ્ય બને છે અને કટ-ઓક તારીખે શેર ધરાવે છે તેઓ તેમના મતદાન અધિકારોનો ઉપયોગ કરી શકે છે. evoting@nsdl.co.in પર વિનંતી મોકલીને લોગિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જે સભ્યોએ તેમનું ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવ્યું નથી તેઓને લિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ડીપી(ઓ) દ્વારા ડિપોઝિટરીમાં ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખેલા શેરના સંદર્શમાં ખૂનું કંપનીના આરટીએ બિગ્ શેર ્રસર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડને પુત્ર લખીને શેરના શીતિક સ્વરૂપના સંબંધમાં નોંધણી કરાવે. A-802, સમુદ્ર ક્ષેપ્ર્યલેક્સ, અમદાવાદ 380009, ટેલિફોન. 079 40392571, ઇમેઇલ- bssahd@bigshareonline.com

AGM (VC/OAVM) દરમિયાન એજીએમ દરમિયાન ઈ- વોટિંગની સુવિધા ઠરાવો પર ઈ-વોટ નાખવાની રીત

ઉપલબ્ધ રહેશે. જે સભ્યોએ એજીએમ પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તેઓ એજીએમમાં વીસી / ઓએવીએમ દ્વારા ફાજર રહી શકે છે પરંતુ તેઓ એજીએમ દરમિયાન ફરીથી તેમનો ઈ-વોટ આપવા માટે હકદાર રહેશે નહીં. નેશનલ મિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ

માળ), હેરિટેજ ફોરાઇઝન, ફોટેલ દેવ કોર્પોરેટની

સામે સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ-

380009. ઈમેલ: evoting@nsdl.co.in અથવા

ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ અને VC/OAVM પ્લેટફોર્મ પ્રદાતા નિષ્પક્ષ અને પારદર્શક રીતે દૂરસ્થ

કંપનીએ શ્રી કિંજલ શાહ, પ્રેક્ટિસિંગ કંપની ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ પ્રક્રિયાની સેક્રેટરીને સ્કૂટિનાઇઝર તરીકે નિયુક્ત કર્યા છે. યકાસણી કરવા માટે સ્ક્રુટિનાઈઝર શ્રી સચિન કારેલીયા . આસિસ્ટન્ટ મેનેજર. નેશનલ રિમોટ ઈ- વોર્ટિંગ સિસ્ટમ અને સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, 402(ચોથો

એજીએમમાં ઈ- વોટિંગ અને એજીએમમાં કાજરી આપવા સાથે જોડાયેલી ફરિયાદોના નિરાકરણ માટે જવાબદાર વ્યક્તિની સંપર્ક

વિગતો ડિપોઝિટરી એટલે કે NSDL અને CDSL દ્વારા લોગિન સંબંધિત ક્રોઈપણ તકનીકી સમસ્યાઓ માટે ડીમેટ મોડમાં સિક્યોરિટીઝ ધરાવતા વ્યક્તિગત શેરધારકો

ટોલ ફ્રી નંબર પર ક્રૉલ કરો. 1800 1020 990 અને 1800 22 44 30 NSDL- ઈમેલ:

evoting@nsdl.co.in અથવા નંબર 022 - 4886 7000 અને 022 - 2499 7000 पर डॉल डरी.

અથવા 1800 22 55 33 પર ક્રોલ કરો

helpdesk.evoting

બોર્ડના આદેશ અનુસાર આદિનાથ એકઝીમ રીસોર્સીસ લિમિટેડ મનોજ શાંતિલાલ સાવલ ਮੋਕੇਨਾਂગ ਤਾਕਵੇਨਣਵ - DIN: 01529306

પ્રસ્તાવના ફોર્મ સાથે, પોલિસીધારકને અધિકારનો ઉપયોગ કરતાં ગ્રાહકો માટે, કરવી આવશ્યક છે. ૧૫ દિવસની અંદર પ્રદાન કરવી વીમા કંપનીઓએ કલેઈમ પ્રાપ્ત થયાનાં જોઈએ.સ્વાસ્થ્ય વીમાના કિસ્સામાં સાત દિવસની અંદર રિફંડની પ્રક્રિયા લાક્ષણિકતાઓમાં વીમા કરારનાં

મુંબઇમાં ટાઇમ્સ ટાવરમાં ભયાનક આગ મુંબઇ, તા. ૬ ચોકીદાર સહિતના લોકો અંદર સ્વાસ્થ્ય વીમા પોલિસી માટે ૩૦ મુંબઇમાં વર્લી સ્થિત ટાઈમ્સ હોવાનું માનવામાં આવે છે અને તેના

ટાવર પર આજે સવારે લાગેલી કારણે ફાયર બ્રિગેડે મોટુ ઓપરેશન ભીષણ આગમાં આ ૧૪ માળની હાથ ધર્યુ છે. આ આગને મેજર

સવારે ૬.૩૦

કલાકે આ આગ લાગી હતી. જેના આવ્યા છે. પર કાબુ કરવા ફાયર બ્રિગેડના આઠ ફાયર ફાઇટર ઝઝ્મી રહ્યા છે. લોઅર આવેલા ટાઇમ્સ ટાવરમાં જોકે આ ઇમારતમાં સામાન્ય રીતે લોકો માર્યા ગયા હતા અને તે રાત્રી બાદ કોઇ રહેતા નથી પરંતુ ઘટનાની યાદ તાજા થઇ છે.

ઇમારતમાં અનેક લોકો ફસાયા કોલ તરીકે જાહેર કરાયો છે અને હોવાની શંકા છે. **૧૪ માળની ઇમારતમાં** આસપાસના હજુ સુધી કોઇ **૧૦૦૦** અન્ય ફાયર હજુ સુધી કોઇ **ત્રીજાથી સાતમા માળ** બ્રિગેડને પણ અહેવાલ નથી. **સુધી આગ કેલાઇ** સહાયતા માટે બો લાવવામાં

૧૪ માળની ઇમારતમાં ત્રીજાથી સાતમા માળ સુધી આગના લબકારા અને ધુમાડા ફેલાયા છે અને આ આગ લાગી હતી. જે પ્રારંભમાં કમલા મીલ કમ્પાઉન્ડમાં ર૦૧૭માં અત્યંત ભયંકર નજરે ચડતી હતી. જ આ પ્રમાણે એક આગમાં ૧૪

> Appellant's Advocate Mr. H.M.Shroff **PUBLIC SUMMONS** In the Court of Small Causes Court No.3, At. Ahmedabad

Suit No. SMST R - 1847/2022

: Punjab National Bank

Defendants : 2) Ms. Pradhuman U. Mehta

Address: 128/1, Silver Alaknanda Bunglow, Nr Dental Collage, Ghuma-Manipur Road, Ghuma, Ahmedabad-380058

Address: Anandnagar Cross Road, 100 feet Ring Road, Satellit Ahmedabad-380052

Suit Valued at Rs.5.00.639/

You, The Defendant are hereby informed that the above named Plaintiff has instituted the above mentioned Special Summary Suit against you for recovery of Rs. 5,00,639/- with interest.

The court has tried to serve the summons upon you through RPAD. The Summons as well as the court process was returned unserved. In the above circumstances, the public Summons is hereby issued by way of publication in the daily News paper as per the Order passed below Exh-14 by the Hon'ble Court.

Where the plaintiff above named has instituted a suit against you, the Defendants under order XXXVII of the Code of Civil Procedure,1908, for Rs.5,00,639/- with interest. You are hereby summoned to cause an appearance to be tendered for you paper, in default whereof the plaintiff will be entitled, after the expiration of the said period of ten days, to obtain a decree for any sum not exceeding the sum Rs.5,00,639/- and such amount as the court may award for cost together with such interests, if any as the court may order.

If you, the Defendants cause an appearance to be entered for you, the Plaintiff will thereafter, serve upon you a summons for judgment at the hearing of which you will be entitled to move the court for leave to defend the suit.

Leave to defend may be obtained if you satisfy the court by affidavit of otherwise that there is a defence to the suit on the merits, or that is reasonable that should be allowed to defend suit.

Given under my hand and the seal of the Cour this 30th day of August, 2024.

Prepared By (B.P.Joshi)

Compared By (M. H. Makwana)

(J. H. Navak) Registrar Small Cause Court

Bench Clerk Ahmedabad Superintendent Grade-II 네૨મ સિક્ચોરિટીઝ લિમિટેડ || CIN: L65100GJ2011PLC064964

રજિસ્ટર્ડ ઓફિસ : ગ્રાઉન્ડ એન્ડ ફર્સ્ટ ફ્લોર, ૭, નટવરશ્યામ કો ઓપ હા. સો. લિ. ઓર્કિડ પાર્ક સામે, રામદેવનગર રોડ, સેટેલાઈટ, અમદાવાદ - 380051 GJ IN Mob.: 9925266150 || Website: www.veeramsecuritiesItd.com || Email ld; veeramsecurities2011@gmail.co

૧૩મી વાર્ષિક જનરલ મીટિંગની નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે વીરમ સિક્યોરિટીઝ લિમિટેડના સભ્યોની ૧૩મી વાર્ષિક જનરલ સભા (AGM) સોમવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સ ("VC") દ્વારાવ્યાપારવ્યવહારકરવામાટે યોજાવાનીછે. ૧૩મી એજીએમની નોટિસમાં નિર્ધારિત કરવામાં આવી છે, જે એજીએમ બોલાવવા માટે પ્રસારિત કરવામાં આવી રહી છે. કંપનીએ પહેલાથી જ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ ઈલેક્ટોનિક મોડ દ્વારા ૧ ૩મી એજીએમ બોલાવવાની નોટિસ સાથે એવા શેરધારકોને મોકલી દીધો છે કે જેમના ઈમેલ એડ્રેસ કંપની અને/અથવા ડિપોઝિટરીઝમાં કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને સિક્થોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા પરિપત્રો અનુસાર નોંધાયેલા છે. ૧૩મી એજીએમની સૂચના સાથેનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.veeramsecuritiesItd.com પર અને નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ

(NSDL) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ મુજબ કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦, સેબીના નિયમન ૪૪ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ અને સેકેટરીયલ સ્ટાન્ડર્ડ્સ સામાન્ય મીટિંગ ("SS-2" ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેકેટરી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ, કંપની તેના તમામ સભ્યો ઈલેક્ટ્રોનિક માધ્યમો (ઈ-વોટિંગ) નો ઉપયોગ કરીને એજીએમની સૂચનામાં નિર્ધારિત તમામ ઠરાવો પર પર તેમનો મત આપવા માટે સુવિધા પૂરી પાડે છે. NSDL દોરા પૂરી પાડવામાં આવેલ ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ. સભ્યોના મતદાન અધિકારો સોમવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ ("કટ-ઓફ તારીખ") ના રોજ કંપનીના પેઇડ અપ ઇક્વિટી શેરમાં તેમના દ્વારા રાખવામાં આવેલ ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે, જે મુજબ વિગતો જરૂરી છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈ અને તેના હેઠળ બનાવેલા નિયમો નીચે આપેલ છેઃ

૧) બુકબંધ કરવાનો સમયગાળો ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શરૂ થશે અને ૩૦મી

સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે (બંને દિવસો સહિત); ૨) રીમોટ ઈ-વોટિંગનો સમયગાળો શુક્રવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે શરૂ થશે અને રવિવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે ૩) ઈ-વોંટિંગના અધિકારો નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ સોમવાર, ૨૩મી સપ્ટેમ્બર

૪) સભ્યોને ઉપરોક્ત ઉક્ષેખિત સમયગાળા પછી દૂરસ્થ ઈ-વોટિંગ દ્વારા મતદાન કરવાની મંજૂર આપવામાં આવશે નહીં:

પ) શેરહોલ્ડર કંપનીનો હિસ્સો મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખે શેર હોલ્ડ કર્યા પછી કંપનીના સભ્ય બને છે તેઓ તેમના મતદાન અધિકારોનો ઉપયોગ કરવા મા એજીએમની સૂચનામાં ઉક્ષેખિત પગલાંને અનુસરી શકે છે; દ) જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગદ્વારા તેમનો મત આપ્યો છે તેઓ પણ એજીએમમાં

હાજરી આપી શકે છે / ભાગ લઈ શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવામાટે હકદાર નથી. ૭) બોર્ડે મેસર્સ નીલમ સોમાણી એન્ડ એસોસિએટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી ઈ-વોર્ટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્કૂટિનાઈઝર તરીકે નિમણુંક કરી છે, જેઓ વોટિંગના પરિણામો ચેરમેન મબમિટ કરશે.

૮) રિમોટ ઈ-વોટિંગને લગતી કોઈપણ પ્રશ્નો / ફરિયાદોના કિસ્સામાં તમે શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો ('FAQs') અને મદદ વિભાગ હેઠળ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર સુંપર્ક કરો

તારીખ : ૦૬-૦૯-૨૦૨૪ સ્થળ : અમદાવાદ

વીરમ સિક્યોરિટીઝ લિમિટેડ માટે sd/- **મહેન્દ્રભાઈ રમણીકલાલ શાહ** મેનેજિંગ ડિરેકેટર -DIN:03144827

વોટ્સએપ-ટેલિગ્રામ હવે 'ટ્રાઇ'ના

રોકવા માટે નવાં પગલાં લીધાં છે. આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓને સૂચનાઓ આપવામાં આવી છે સાથે

આઇટી મંત્રાલય પાસેથી પણ સહકાર માંગવામાં વોટસએપ અને ટેલિગ્રામ જેવી

એપ્સ પર ફ્રોડ

કહેવામાં આવ્યું હતું. હાલમાં આવા કોલ રોકવા માટે કામ ચાલી રહ્યું મંત્રાલય પર દબાણ કર્યું છે. વોટ્સએપ અને ટેલિગ્રામની મદદથી આવી અનેક છેતરપિંડી થઈ રહી છે. આ તમામ એપ્સ આઇટી મંત્રાલયના

आ२ओ જવેલ્સ લિમિટેડ ||CIN: L74999GJ2018PLC105540 ર**િજસ્ટર્ડ ઓફિસ** : ૭૦૭, એડોર એસ્પાયર, ગુલબાઈ ટેકરા BRTS બસ સ્ટોપ નજીક, યુનિવર્સિટી થી પાંજરાપોળ રોડ, અમદાવાદ, ગુજરાત, ૩૮૦૦૧૫ ||Contact: 079-22144429 || Website : rojewels.co.in || Email : compliancerojewels@gmail.com

ક્ટ્રી વાર્ષિક જનરલ મીટિંગની નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે આરઓ જવેલ્સ લિમિટેડના સભ્યોની *દ*ઢી વાર્ષિક જનરલ સભા (AGM) સોમવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે વિડિયો ક્રોન્ફરન્સ ("VC") દ્વારા વ્યાપાર વ્યવહાર કરવા માટે યોજાવાની છે. દૃઢી એજીએમની નોટિસમાં નિર્ધારિત કરવામાં આવી છે, જે એજીએમ બોલાવવા માટે પ્રસારિત કરવામાં આવી રહી છે. કંપનીએ પહેલાથી ′ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા ૬ઠ્ઠી એજીએમ મોલાવવાની નોટિસ સાથે એવા શેરધારકોને મોકલી દીધો છે કે જેમના ઈમેલ એડ્રેસ કંપની અને બથવા ડિપોઝિટરીઝમાં કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડ્રિયા દ્વારા જારી કરાયેલા પરિપત્રો અનુસાર નોંધાયેલા છે. દક્રી એજીએમની નોટિસ્ સાથેનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.rojewels.co.in પર અને નેશનલ સિક્ચોરિટીઝ ડેપોઝિટરી લિમિટેડ (NSDL) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ મુજબ કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦, સેબીના નિયમન ૪૪ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ અને સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ્સ સામાન્ય મીટિંગ ("SS-2") ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ, કંપની તેના તમામ સભ્યોને ઈલેક્ટ્રોનિંક માધ્યમો (ઈ-વોટિંગ) નો ઉપયોગ કરીને એજીએમની સૂચનામાં નિર્ધારિત તમામ ઠરાવો પર પર તેમનો વોટ આપવા માટે સુવિધા પૂરી પાડે છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમNSDL દ્વારા પૂરી પાડવામાં આવે છે. સભ્યોના વોટિંગ અધિકારો સોમવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ ("ક્ટ-ઓફ તારીખ") ના રોજ કંપનીના પેઇડ અપ ઇક્વિટી શેરમાં તેમના દ્વારા રાખવામાં આવેલા

ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે, જે મુજબ વિગતો જરૂરી છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈ અને તેના હેઠળ બનાવેલા નિયમો નીચે આપેલ છેઃ ૧) બુક બંધ કરવાનો સમયગાળો ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શરૂ થશે અને

૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે (બંને દિવસો સહિત); ૨) રીમોટ ઈ-વોટિંગનો સમયગાળો શુક્રવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે શરૂ થશે અને રવિવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે. ૩) ઈ-વોટિંગના અધિકારો નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ સોમવાર, ૨૩મી

૪) સભ્યોને ઉપરોક્ત ઉંક્ષેખિત સમયગાળા પછી દૂરસ્થ ઈ-વોટિંગ દ્વારા મતદાન કરવાની

મંજૂરી આપવામાં આવશે નહીં; પ) શેરહોલ્ડર કંપનીનો હિસ્સો મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખે શેર હોલ્ડ કર્યા પછી કંપનીના સભ્ય બને છે તેઓ તેમના મતદાન અધિકારોનો ઉપયોગ કરવા માટે એજીએમની સૂચનામાં ઉક્ષેખિત પગલાંને અનુસરી શકે છે;

૬) જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોર્ટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ પણ એજીએમમ હાજરી આપી શકે છે / ભાગ લઈ શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવામાટે હકદાર નથી. ૭) બોર્ડે મેસર્સ નીલમ સોમાણી એન્ડ એસોસિએટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્ક્રૂટિનાઈઝર તરીકે નિમણુંક કરી છે, જેઓ વોટિંગના પરિણામો ચેરમેનને સબમિટ કરશે.

૮) રિમોટ ઈ-વોટિંગને લગતી કોઈપણ પ્રશ્નો / ફરિયાદોના કિસ્સામાં તમે શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો ('FAQs') અને મદદ વિભાગ હેઠળ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩૫૨ સંપર્ક કરો

તારીખ: ૦૬-૦૯-૨૦૨૪

આરઓ જ્વેલ્સ લિમિટેડ માટે sd/- **શુભમ ભરતભાઈ શાહ** મેનેજિંગ ડિરેકટર - DIN : 08300065

RIDDHI CORPORATE SERVICES LIMITED

Regd. Office: 10, Mill Officers Colony, Behind Old RBI, Ashram Road, Ahmedabad GJ -380009 Contact No.: 079-26580767, Email: investor@rcspl.net Website: www.riddhicorporate.co.in CIN: L74140GJ2010PLC062548

NOTICE OF THE 14TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE **E-VOTING INFORMATION** Notice is hereby given that the 13th Annual General Meeting (14th AGM)

of the Members of Riddhi Corporate Services Limited will be held on Saturday, 28th September, 2024 at 11:00 a.m. to transact the business as set out in the Notice of the 14th AGM. The Company has sent the Annual Report along with Notice convening AGM on Friday, 6th September, 2024, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent, M/s. Purva Shareregistry (India) Pvt. Ltd. / Depository Participant(s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with its circulars dated 8th April, 2020 and 13th April, 2020 and the Securities and Exchange Board of India circular dated 12th May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.riddhicorporate.co.in,BSE Limited at www.bseindia.coma nd on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Act, 2013; the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Sunday 22nd September, 2024 to Saturday 28th September, 2024 (both the days inclusive) for the purpose o 14th AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through voting services provided by the CDSL on all resolutions as set forth in the 14th AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Saturday, September, 21, 2024 ('cut-off date') The remote e-voting period commences on Wednesday, 25th September, 2024 at 9.00 a.m. and will end on Friday, 27th September, 2024 at 5.00 p.m. uring this period, the Members may cast their vote electronically. remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM. The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and for members who have not

registered their email addresses is provided in the Notice of the AGM. Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

Registration of e-mail addresses:

Place: Ahmedabad

Date: 06-09-2024

Members whose email addresses are already registered with the Company Depositories, may follow the instructions for e-voting during the AGM as provided in the Notice of the AGM. Members whose email addresses are not registered with the Company/ Depository may follow the below process for registering or updating their email addresses.

Members holding shares in electronic/ Demat form, please update your email address with your Depository Participants. However, Members may emporarily register the same with the Company's Registrar & Share Transfer Agent i.e. M/s. Purva Shareregistry (India) Pvt. Ltd. at https:/ www.purvashare.com/email-and-phone-updation/ on their website www.purvashare.com/ in the Register your Email id tab by providing details such as Name, DP ID, Client ID, PAN, mobile number and e-mail address. In case of any queries pertaining to e-voting members may refer to the requently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com

For, Riddhi Corporate Services Limited sd/- Mustafa Mufaddalbhai Sibatra Company Secretary & Compliance Officer

DEV IT Simplified

DEV INFORMATION TECHNOLOGY LIMITED

CIN: L30000GJ1997PLC033479 Registered Office: 14, Aaryans Corporate Park, Nr. Shilaj Railway Crossing, Thaltej, Ahmedabad, Gujarat - 380059 India Phone: +91 9429899852 / 53 Email: investor@devitpl.com/cs@devitpl.com Website: https://www.devitpl.com

ANNUAL GENERAL MEETING (AGM) NOTICE Notice is hereby given that the 27th ANNUAL GENERAL MEETING (AGM) of the members of DEV INFORMATION TECHNOLOGY LIMITED ("the Company") will be held on Monday, the 30th day of September, 2024 at 09:00 A.M. at through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM"), to transact the businesses as set out in the notice of the AGM. In accordance with the General Circular ssued by the Ministry of Corporate Affairs dated May 5, 2020 read with General Science Circulars dated April 8, 2020 and April 13, 2020 (collectively referred to as 'MC/ Circulars') and Securities and Exchange Board of India ('SEBI') Circular dated May 12, 2020, the Company has sent the Notice of the 27th AGM along with its Annual Report 2023-24 on September 06, 2024 through electronic mode only to those Members whose e-mail addresses are registered with the Company of Registrar & Transfer Agent and Depositories. The requirement of sending physical copies of the Notice of the AGM along with the annual report has been dispensed with vide MCA Circulars and the SEBI Circular. The company has appointed

National Securities Depository Limited to conduct the e-voting process The Annual Report of the company for the financial year 2023-24, inter alia containing the notice of the AGM is available on the company's website at www.devitpl.com and also on the stock exchange website a www.nseindia.com. A copy of the same is also available on the website o National Securities Depository Limited ('NSDL') at www.evoting.nsdl.com. **BOOK CLOSURE NOTICE**

All shareholders of the company are informed that the Register of Members and the Share Transfer Books of the company will be closed from Tuesday, 24th September, 2024 to Sunday, 29th September, 2024 (both days inclusive) for the purpose of AGM and the final dividend for financial year 2023-24. The Cut-off date for the purpose of final dividend is Monday, 23rd September 2024. The final dividend (if it's approved in the AGM) then it shall be paid to those equity shareholders, whose names stands registered on the Company's

Register of Members: a. As Beneficial Owners as at the end of business hours on Monday, 23rd September, 2024 as per the list provided by National Securities Depositor imited and Central Depository Services (India) Limited in respect of the

shares held in the electronic form REMOTE E-VOTING

Pursuant to provisions of section 108 and other applicable provisions of the Companies Act, 2013, read with the Companies (Management and Administration Rules, 2014, and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the company is pleased to provide its members the facility to exercise their right to vote either through the remote e-voting before or during the AGM in respect of resolutions proposed to be passed at the 26th AGM of the company and for this purpose company has appointed (NSDL) to provide the e-voting facilities. The detailed instructions for remote e-Voting are given in the Notice of the AGM.

. The remote e-Voting facility would be available during the following period Commencement of remote e-Voting: Thursday, 26th September, 2024 at 9:00 a.m. End of remote e-Voting: Sunday, 29th September, 2024 on 5:00 p.m. The remote e-Voting module shall be disabled by NSDL for voting thereafter and Members will not be allowed to vote electronically beyond the said date and time; 2. The Cut-off date for the purpose of e-voting is Monday, 23rd September, 2024

Members whose names appear on Register of Members on Monday, 23rd September, 2024 are entitled to vote through e-voting; The members who are entitled to vote and participate in the AGM and have not cast their vote on the resolutions through remote e-voting before AGM shall be eligible to vote during the AGM:

4. Any person who acquires shares of the Company and becomes a Member of the Company after the dispatch of the Notice and holds shares as on the Cut-Of Date, may obtain the login-id and password for remote e-Voting by sending a request at evoting@nsdl.co. or may contact on toll free number 1800-222-990, as provided by NSDL. A person who is not a Member as on the Cut-Off Date uld treat the Notice of the AGM for information purposes only 5. The members who have voted though remote e-voting before the AGM are also entitled to attend/ participate in the AGM but not entitled to cast their vote during the meeting

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) fo section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990. For, Dev Information Technology Limited Date: 07/09/2024 sd/- Krisa Shah

Place: Ahmedabad

Members are requested to note the following:

માટે હેલ્પ ડેસ્ક

पारी**भ : ०**९-०६-२०२४

Company Secretary & Compliance Officer



🦷 सिंडिकेट Syndicate

Circle Office, 7th Floor, Gift One Building,

The undersigned as Authorized officer of CANARA BANK has taken over possession of the following property/ies under section 13(4) of the | E-AUCTION SALE NOTICE SARFAESI act, Public at large is informed that e-auction (under SARFAESI act, 2002) of the charged property/ies in the below mentioned cases for realization of bank dues will be held on "AS IS WHERE IS, AS IS WHAT IS AND WHATEVER THERE IS" BASIS Under Rule 9 (1) of Security Interest (Enforcement) Rules, 2002.

TO PUBLIC UNDER SARFAESI ACT, 2002

DETAILS FOR MEGA E-AUCTION ON 09.10.2024 (01:00 PM TO 03:00 PM) LAST DATE OF EMD: 08.10.2024

Sr.		OUTSTANDING	DETAILS OF SECURITY/IES /	RESERVE PRICE	ACCOUNT DETAILS & NAME, CONTACT DETAIL	Sr.		OUTSTANDING		RESERVE PRICE	ACCOUNT DETAILS & NAME. CONTACT DETAIL
lo.	D. / GUARANTOR/S / MORTGAGOR/S	(RS)	STATUS OF POSSESSION	& EMD	OF BRANCH	No.	lo. / GUARANTOR/S / MORTGAGOR/S	(RS)	STATUS OF POSSESSION	& EMD	OF BRANCH
7			PERTIES OF VADODARA REGIONAL OFFICE						OPERTIES OF VADODARA REGIONAL OFFICE		
	Miss Parthvi Pankaj Parekh (Borrower/Mortgagor) Mrs. Hema Pankaj Parekh (Co-Borrower/Mortgagor) Mr. Pankaj Parekh (Co-Borrower/Mortgagor)	as per demand Notice dated 04-05-2024 plus interest and charges thereon less recovery (if any)	All that piece and parcel of immovable property being Total admeasuring area 58983 Sq. Mtrs paiki land having Revenue Survey No. 402,405, 'B' bearing Tika No. 27/12, City Survey No. 3586/1/A, 2971.50 Sq. Mtrs. & 330.00 Sq. Mtrs Land is reserved common road Vadodara Mahanagar Seva Sadan, vide no. sanction Lay-out Plan H.B./11-2014-2015 Dt 9.1.2015 and approved on the basis of this the construction in the name of "SAI SHUKAN" is made out of this is formed Flats, out of which "Satyam-B" Tower 12th floor Penthouse No. Satyam –B-1201, admeasuring 160.75	Rs. 73,05,000/- EMD Rs. 7,30,500/-	Alkapuri Branch Ph. No.8238011405 Email: cb0160@canarabank.com Account No: 209272434 IFSC: CNRB0000160		Mr Yash Bharatkumar Mistry Proprietor), Mr Bharatkumar Babubhai Mistry (Guarantor and Mortgagor), Mrs Heenaben Bharatkumar Mistry (Guarantor and Mortgagor)	as per demand notice dated 11-09-2023 plus further interest and other charges due less recovery if any	Vadodara lying being land R.S no 33 Pitamber Co Op Housing Society Ltd Known as "SAMRAJYA" Unit No E/19 Adm. 53.29 Sq Mtrs. At registration District & Sub District Vadodara at District Vadodara. Bounded as under: East: Common Plot, West: By Internal Road and Unit No E/18, North: By Unit No E/20, South: By Plot No 6 of R.S Ni 33/p Status of Possession: Physical	Rs. 55,20,000/- EMD Rs. 5,52,000/-	Ph.: 8238011405/9785476 E-mail id: cb0160@canarabank.cc A/c No:209272434 IFSC: CNRB0000160
	W/o Brahmbhatt Chirag,	Rs. 29,35,757.86 as on 19.03.2024	Sq. Mts. & 17.23 Sq. Mts. Terráce both total 177.98 Sq. Mts. Built up respectively and with Slab level construction is made. East: Open Space, West: Penthouse B-1204, North: Penthouse A-1202, South: Penthouse B-1202. Status of Possession: Symbolic All the piece and parcel of non agricultural plot of land bearing R.S.No. 250 paikki 2, 250 paikki 3, TPS 29, FP No. 135 area	Rs. 31,60,000/-		50	60 Vijaykumar Ramanbhai Solanki (Borrower and Mortgagor), Minaben Vijaykumar Solanki (Guarantor) Ramanbhai Maganbhai Solanki (Guarantor)	as per demand notice date 01-08-2023 plus further interest and other charges	d no-15824 of Revenue Survey No-41 Piki 7, (Non Agricultural Land for Residential purpose), Paiki Private Plot no-24 Paiki Southern side area 205.00 Sq. Mtrs, land Paiki Middle Portion Area 82.50 Sq.	Rs. 15,36,000/- EMD Rs. 1,53,600/-	Godhra Branch: Ph.: 8238070598/978547 E-mail id: cb4824@canarabank.c A/c No:209272434 IFSC: CNRB000482
	(Borrower/Mortgagor)	plus interest w.e.f. 19-03-2024 and charges thereon less recovery (if any),	admeasuring 5528 Sq Mtrs., paikki land area admeasuring 4441.80 sq. Mtrs., paikki area admeasuring 4349.82 Sq. Mtrs. In constructed the scheme in the & style of "TH5 AVENUE" Tower A, First Floor, Flat No. A-104, construction area admeasuring 650.00 Sq. Fts., of Mauje Village Manjalpur, at Registration Sub District & District Vadodara and bounded as under: North: By 18.00 mtr., Main Road South: By Garden area East: By Flat no. 103 West: By Society Internal 7.50 Mtrs. Road Status of Possession: Symbolic	EMD Rs. 3,16,000/-	Manjalpur Branch Ph. 919731708459 / 9785475937 E-mail id: cb17063@canarabank.com A/c No : 209272434 IFSC : CNRB0017063	51	11 Ritu Nishad (Legal heir of Ajay Kumar Vidhyaram) Ramvati, (Legal heir of Ajay Kumar Vidhyaram) Late Ajay Kumar Vidhyaram (Mortagor)	if any Rs. 14,55,971.04 as per demand notice dated 29-07-2023 plus further interest w.e.f. 12-07-2023	Status of Possession: Physical Registration District: Narmada Sub District Nandod Land Bearing (Old Block/Survey No. 891/78) New Block/Survey No.1955 House No. 78 measurement area of land 69.72 sq. mtrs., undivided share of land 53.00 sq. mtrs., total land area 122.72, built up area 69.72 sq mtrs., in the area known as Chandravilla Bungalows of Moje	Rs. 12,56,000/- EMD Rs. 1,25,600/-	Rajpipla Branch: Ph.: 82380920013/978547 E-mail id: cb3425@canarabank.cc A/c No:209272434 IFSC: CNRB0003428
	2 Vishal Jayantibhai Gajjar (Borrower/Mortgagor)	as per demand notice dated 22-02-2024 plus further Interest and charges thereon less recovery (if any)	Atladara, Vadodara lying bearing Final Plot No.71, Old R.S.No. 417/2/4 Paikki, F.P.No.71, O.P.No.71, C.S.No.1288 Total admeasuring 16146 Sq.Fts. T.P.Scheme No.20 admeasuring 1500 Sq.Mtrs. Known as "MAPLE MEADOWS" Paikki First Floor, Flat No.B-106, Construction admeasuring 63.25 Sq.Mtrs., ie. 680.88 Sq.Fts., Built up & Open Terrace & Undivided Share of Common Plot Admeasuring 21.11 Sq.Mtrs., ie. 227.27 Sq.Fts. At Registration Sub District & District Vadodara. Bounded as: North-	Rs. 24,30,000/-				Rs. 6,94,398.26 as per demand notice date 05-04-2023 plus further interest and other charges due less recovery if any	All the piece and parcel of Land & Building at Godhra Kasba R S No. 1169/4 Paiki 47/Paiki 2, Private Plot no. 56, Paiki admeasuring 84-00 sq mtrs southern side land admeasuring 42-00 sq mtrs constructed Muni House No- I/255/ZS/56/1 situated in Jhulelal Society, Opposite FCI, Godhra Kasba, taluka Godhra, Distes Panchmahal. Bounded as: East: 7.5 mtrs Road, West: Private Plot No. 35, North: Private Plot No57, South: Remaining land of this plot. Status of Possession: Physical	EMD Rs. 91,200/-	Godhra Branch : Ph.: 8238070598/978547 E-mail id: cb4824@canarabank.c A/c No:209272434 IFSC : CNRB000482
43			[Sq.Mts. 49-84] [Built up area G.F. Sq. Mts. 39-00+ F.F. Sq. Mts. 35-00 total built up sq.mts. 74-00] of N.A. land S.No. 1311 known as 'Pramukh Swami Park' situated at village Madhapar, Taluka Morbi, District Morbi. Bounded as: East-Adj. S.No. Land, West- this N.A.	Rs. 20,25,000/-	Bharuch Branch		3 Jijjumon Velayudhan (Borrower / Mortgagor) Neelam Kumari (Co Borrower / Mortgagor)	as per demand notice dated 04-01-2023 plus further interest and other charges	Tower" part -2 R.S.No. 766/3 T.P.Scheme No. 7, Final Plot no. 302, s City Anand, Taluka of Anand, District Gujarat. East- Flat No. 304,	RESERVE PRICE Rs. 14,44,000/- EMD Rs. 1,44,400/-	Anand Branch : Ph.: 8238091946/ 8004278910/9785475 E-mail id:
	M/s Janiya Fine Chem Rakesh Shamjibhai Bhalodiya	Rs. 1,01,43,055.91	toad, North- this Plot No. 6p Land, South- this Plot No. 6p Land Status of Possession: Symbolic Deen Plot No. 145 total sq. fts. 1205-12 [Sq.Mts. 112-00] of N.A. and S.No. 157 known as 'Gajanand Park' situated at Village Pipli, aluka Morbi, Dist. Morbi. Bounded as: East-Adj. Plot No.134, Vest- this N.A. Road, North- Adj. Plot No.146, South- Adj. Plot	RESERVE PRICE Rs. 5,40,000/-	_ Ph. 02642-261991/	55		as per demand notice dated 24-12-2021 plus further interest and other charges due less recovery if any	Railway Crossing, Vallabh Vidyanagar-688120, Dist Anand Gujarat, Bounded as: North-boundary of plot and then plot no 431, South-Flat no. T-1 (Half Height)-Common Wall, East-Boundary of the plot and then Plot no 433, West-Stair Passage and then Flat no. T-3. Status of Possession: Symbolic	Rs. 8,02,000/- EMD Rs. 80,200	cb0163@canarabank A/c No:20927243 IFSC : CNRB0000
45	(Partner) Nandlal Shamjibhai Bhalodiya and Pradipbhai Mansukhbhai	notice dated 08-01-2024 plus further interest and other charges due less recovery if any	Ground Floor Shop No. 2, sq.ft. 220-82 [Sq.Mts. 20-52] standing on plot no. 2[p] south side of N.A. land S. No. 133p1/p1 situated at sillage Sartanpar, Taluka Wankaner, Dist. Morbi Bounded as: East-7 Adj. Shop No. 3, West-Adj. Shop No. 1, North-This plot No. 2p open land, South- Open Land thereafter National Highway to Sartanpar Gada Marag	RESERVE PRICE Rs. 6,21,000/-	cb17060@canarabank.com A/c No : 209272434 IFSC : CNRB0017060			Rs 13,07,774.73 as per demand notice dated 04-11-2022 plus further interest and other charges due less recovery if any	Dwalling, Tarsali, R.S.No. 434/2 paiki mouje—Tarsali, adm. 56.21 sq. mtr. super built up. Status of Possession : Symbolic	Rs. 9,82,000/- EMD Rs. 98,200/-	Ph.: 8238092029,97854 E-mail id: cb2631@canarabank A/c No:209272434 IFSC: CNRB00026
46			Status of Possession : Symbolic	Rs. 4,41,000/-				as per demand notice date 24-09-2019 plus further interest and other charges due less recovery if any	sq. mtrs. In TP Scheme no. 1 FP No. 480, paiki A Type Plot No. 7A, Anand Nagar palika, Property No. 2/9/49 Mouje Anand East-Property FP No. 480 paiki TP Scheme No. 1, West-80 feet road in TP Scheme No. 1, North-FP No. 480 paiki A type sub plot no. 6/A in TP Scheme No. 1, South-40 feet wide road in TP Scheme no. 1 Status of Possession: Symbolic	Rs. 9,23,000/- EMD Rs.92,300/-	Ph.: 8238091946 8004278910/978547: E-mail id: cb0163@canarabank A/c No:20927243 IFSC: CNRB0000
47							(Borrower/Mortgagor) Manorath Madan Bar (Guarantor)	as on 30.11.2017 plus further interest and other charges due less recovery if any	Flat No: 108, First Floor Harsiddhi Complex Chopdar Faliyu NavaBazar Fatehpura Vadodara, Vibhag A Tikka no:A Tikka no:8/3 CS Bounded by East By: Flat no 101,102,103/Common Passage, er West By: Street, North By: Passage/Flat no 107, South By: Passage/Flat no 109 Status of Possession: Physical	RESERVE PRICE Rs. 6,08,000/- EMD Rs. 60,800/-	Ph.: 0265-242464 09427314783 / 97854 E-mail id: cb17041@canaraban A/c No:20927243 IFSC: CNRB0017
	8 M/s Aditashya Corporation (Borrower), Naranbhai Ganpatbhai Thakor (Guarantor and Mortgagor) Paresh N Patanvadiya (Proprietor)	Rs 24,05,276.94 as per demand notice dated 26-02-2024 plus interest and charges thereon	All the piece and parcel of non agricultural plot of land in Mauje Dumad, Vadodara lying being land bearing Tikka no. 3, C.S. no. 231 admeasuring 35.4172 Sq. Mtrs., at Registration District Vadodara &	EMD Rs. 90,000/-	Fatehgunj Branch: Ph.: 8511100894/9785475937 E-mail id: cb6618@canarabank.com A/c No:209272434 IFSC: CNRB0006618	5ზ	88 Roshni Paresh Soni (Borrower/Mortgagor) Paresh Hasmukhbhai Soni (Borrower) Memon M. Sajid Abdulgafur (Guarantor)	as per demand notice date 09-01-2019 plus further interest and other charges	9 Residential property at Meena Park, Near Masjid , Bhalej Road, d Revenue Survey No 2507/1+2508/1, total admeasuring HC 0.98.13 area 9813.49 sq mtr N.A. Land Paiki Sub Plot no. 43, arae 171.17 sq. mtrs upon construction a house admeasuring 34.29 sq mtr situated lying and being at mouje town Anand Taluka (Bounded by : North- 6 mtr approach road, South- Sub Plot no 44) Status of Possession: Physical	EMD Rs. 1,57,600/-	Anand Branch Ph.: 823809194/ 8004278910/978547 E-mail id: cb0163@canaraban/ A/c No:20927243 IFSC: CNRB0000

(1) Auction will be held on 09.10.2024 from 01:00 pm to 03:00 pm (2) For all the properties The Auction Sale is conducted on "As is what is and Whatever there is" Basis. Bank is not aware of any pending charges, taxes, etc. Purchasers are bound to verify the same and, if any, have to bare the same. (3) Auction / bidding shall only through "Online Electronic Bidding" through the website https://ebkray.in/ Bidders are advised to go through the website (www.canarabank.com) under link E-Auction Sale proceedings (4) The Property can be inspected, with Prior Appointment with Authorized Officer, on 03.10.2024 (5) The Property will not be sold below the Reserve Price and the participating bidders may improve their offer further during auction process. (6) EMD-"EMD amount of 10% of the Reserve Price is to be deposited in E-Wallet of M/s PSB Alliance Private Limited (E-bkray) portal directly or by generating the Challan therein to deposit the EMD through RTGS/NEFT in the account details as mentioned in the said challan." (7) Intending bidders should hold a valid signature certificate and e-mail address. For details with regard to digital signature please contact the service provider M/S PSB Alliance (Ebkray) (For Contact Details please refer Point No 19) Immediately on the same date payment of the EMD amount the bidders shall approach the said service provider for obtaining digital signature (If not holding a valid digital signature) (8) Last date and time for depositing the EMD is 08.10.2024 up to 5.00 PM. after payment of the EMD amount, the intending bidders should send a copy of the following documents /defails on or before date of submission of the bid(s), to Canara Bank, Branch, concerned to the property. (A) Demand Draft/Pay order towards EMD amount if paid through RTGS/NEFT, acknowledgment receipt thereof with UTR No. (B) Photocopies of PAN Card, ID Proof and Address proof. However, successful bidder would have to produce these documents in original to the Bank at the time of making payment of balance amount of 25% of bid amount. (C) Bidders Name, Contact No., Address, E-mail (D) Bidder's A/c. details for online refund of EMD. (9) Last Date & Time for receipt of tender documents: 08.10.2024 up to 05.00 pm (10) The intending bidders should register their names at portal https://ebkray.in/ to get their User ID and password free of cost. Prospective bidder may avail online training on E-auction from the service provider https://ebkray.in/ (For Contact Details please refer Point No 19) (11) EMD deposited by the unsuccessful bidder shall be refunded to them within 7 days of finalization of sale. The EMD shall not carry any interest. (12) The bank will have the absolute right/discretion for acceptance/rejection of any bid and all bidders to undertake not to initiate any legal action against the Bank from non-sale of such denied asset simply because such a bidder was successful/highest bidder. (13) Auction would commence at Reserve Price plus one increment of Rs. 10,000 and bidders shall improve their offers multiplies of Rs. 10,000 (Rs. Ten Thousand), if required. The bidder who submits the highest bid (not below the Reserve Price on closuer of 'Online' auction shall be occired as successful bidder, subject to confirmation of the same by the secured creditor. (14) The successful bidder shall deposit 25% of sale price (inclusive of EMD already paid) immediately on declaring him/her as the successful bidder and the balance within 15 days from the date of confirmation of sale by the successful bedder fails to pay the sale price within the period stated above, the deposit made by him /her shall be forfeited by the Authorized Officer without any notice and property shall forthwith be put for sale again. Notwithstanding contained herein, the confirmation regarding successful bidder is subject to any suit filed/to be filed or any other order by any competent authority/ies/court/tribunal. (15) Where the sale consideration, of the property to be transferred is Rs. 50 Lakhs and above the successful bidder will have to deduct Tax Deducted at Source) TDS @ 1 % on the sale proceeds and deposit the same by furnishing the Challan in form 260B and submit the original receipt of TDS certificate to the Bank (16) All charges for conveyance, stamp duty and registration charges etc., as applicable shall be borne by the successful bidder only. (17) Authorized Officer reserves the right to postpone/cancel or vary the terms and conditions of the e-auction without assigning any reason thereof. (18) In case there are bidders who do not have access to the internet but interested in participating the e-auction, they can approach Canara Bank, Circle Office, Gandhinagar or Concerned Branch of Canara Bank who as a facilitating centre shall make necessary arrangements. (19) For further details Contact M/S PSB Alliance.com - Helpdesk No:-8291220220, 7046612345,6354910172, 9892219848,8160205051, For User Creation Helpline Number:- Mr. Karan Modi-7016716557, Mr Vasu Patel-9510974587, Mr Kashyap Patel -6354604884 and Mr Animesh Jain -7046-612345 (20) The bank is free to sale the property under private treaty or purchase as Non-Banking Assets, out of the above said properties, under the provision of the SARFAESI Act, in case no bidder is turning up for the purchase of property. No future notice Shall be issued for the same. (21) To the best of knowledge and information of the Authorised Officer, there is no encumbrance on the properties. However, the intending bidders should make their own independent inquires regarding the encumbrance, title of properties put on auction and claims/rights/dues/affecting, the property, prior to submitting their bid. The e-auction advertisement does not constitute and will not be demand to constitute any commitment or any representation of the Banks. The property is being sold with all the existing and future encumbrance whether known or unknown to the Bank. Further some properties are available on symbolic possession and few are occupied by tenants/third parties as mentioned in the advertisement which may be noted. The Authorised Officer/Secured Creditors shall not be responsible in any way for any third party claims/rights/dues. (22) Where Factory land, building and Plant and Machinery both are put on auction for any borrower, EMD only for factory land and building will not be considered and sale will be confirmed after the plant machinery are sold out.

For detailed terms and conditions of sale, please refer to the link provided in https://ebkray.in/ and https://www.canarabank.com Also, Prospective Bidders may contact respective Brances/Authorised Officer.

Date: 07.09.2024 | Place: Gandhinagar

Sd/- Authorised Officer, Canara Bank

VEERAM SECURITIES LIMITED

Registered Office : Ground & First Floor, 7, Natvarshyam Co Op Ho S Ld, Opp. Orchid Park, Ramdevnagar Road, Sattelite, Anmedabad 380051 GJ IN || CIN : L65100GJ2011PLC064964

Mob.: 9925266150 || Website: www.veeramsecuritiesltd.com || Email ld: veeramsecurities2011@gmail.com NOTICE OF 13TH ANNUAL GENERAL MEETING

lotice is hereby given that the 13th Annual General Meeting (AGM) of the Members Notice is nereby given that the 13th Annual General Meeting (AGM) of the Member of Veeram Securities Limited is scheduled to be held on Monday, 30th September, 2023 to 03:00 PM through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM) to transact the business as set out in the Notice of the 13th AGM, which is being circulated for convening the AGM. The Company has already dispatched the Annual Report for the Financial Year 2023-24 along with the Notice convening 13th AGM through electronic node to the Shareholders whose email address are registered with the Company and / c Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice of 13th AGM also available on the website of the company at www.veeramsecuritiestld.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com As Per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companie (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on Genera Meeting ("SS-2") issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share of the Company as on Monday, September 23, 2024 (the "cut-off date"). The details are required pursuant to the provision of the Companies Act, 2013 and rules made thereunder are given below:

1) The Book closure period shall commence on 24th September, 2024 and end on 30t September, 2024 (both days inclusive):

The remote e-voting period will commence at 09:00 a.m. on Friday, September 27 124 and will end at 05:00 p.m. on Sunday, September 29, 2024. 3) Cut-off date for determining rights of entitlement of e-voting is Monday, September

23. 2024: The members will not be allowed to vote through remote e-voting beyond the perio as specified above;

5) Shareholder acquiring the share of the company and becomes the members of the

company after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention in the Notice of AGM to exercise their voting rights; 6) The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM but shall not be entitled to cast their vote again. 7) The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Compan cretary to act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall sub

the results of voting to the Chairman. 8)In case of any queries / grievances pertaining to remote e-voting you may refer to th Frequently Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual fo

Shareholders available at www.evoting.nsdl.com under help section or contact at 022 23058542/43

For Veeram Securities Limited Date: 06-09-2024 sd/- Mahenderabhai Ramniklal Shah Place : Ahmedabad Managing Director- DIN: 03144827



Opp.Pioneer Hotel, Silvassa, Dadra Nagar Haveli & Daman and Diu (U.T) PIN-396230 Phone: (+91) 0260-2640352 (D) 2642754,

POSSESSION NOTICE (IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda und Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued demand notices dated 12-06-2024 calling upon the Borrowers / Guarantor / Mortgagor, Mrs Urmilaben Mohanbhai Patel (Borrower & Mortgagor), Mrs.Savitaben Mohanbha Patel (Borrower & Mortgagor) and Mr. Jayesh Mohanbhai Dhondi (Co Borrower) to repay the amount mentioned in the notice being Rs.45,96,290.79/- (Forty Five Lacs Ninety Six Thousand Two Hundred Ninety Rupees and Seventy Nine Paisa only) unapplied Interest + Other charges) as on 09.06.2024 and interest thereon notice date 12-06-2024 within 60 days from the date of receipt of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowe and the public in general that the undersigned has taken possession of the propertie described herein below in exercise of powers conferred on him/her under Sub Section (4 Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement) Rules 2002 on this the 02nd day of September of the year 2024.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal wit the properties and any dealings with the properties will be subject to the charge of the Bank of Baroda, Silvassa Branch, Silvassa for an amount of being Rs.45,96,290.79/-(Forty Five Lacs Ninety Six Thousand Two Hundred Ninety Rupees and Seventy Nine Pais only) + unapplied Interest + Other chargesas on 09-06-2024 and further interest expenses thereon until the full payment.

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act. i respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Properties

Equitable Mortgage of all that R.C.C constructed premises bearing apartment No 301 having 1363 Sq. ft Carpet Area & 1538 Sq. Ft. Built up Area, (without any stilt parking situated on Third Floor in Building -C, in premises known as "VEDA RESIDENC" constructed on the land bearing NA lands bearing survey No 71/2/1, admeasuring 42 Sq. Mtrs., Survey No 71/2/2, admeasuring 1100 Sq. Mtrs. (along with Residential-cum commercial building constructed thereon). Survey No 71/2/3, ad measuring 2540 Sq Mtrs and Survey No 71/2/4, admeasuring 740 Sq. mtrs., Suvey No 72/3, admeasuring 700 Sq. Mtrs. And Survey No 72/1/4P, admeauring 600 Sq. Mtrs; totatling to 6100 Sq. Mtrs of Silvassa, U.T. of Dadra and Nagar Haveli in the name of Urmilaben M Patel and Savitaben Mohanbhai Patel. Bounded: North: Building D/ Internal Road, South: Fla No 302, East: Main Road, West: STAIR CASE/LIFT

Date: 02.09.2024 Sd/- Assistant General Manager & Authorised Office Bank of Baroda, Adivasi Bhava



p Pioneer Hotel, Silvassa, Dadra Nagar Haveli & Daman and J (U.T) PIN-396230 **Phone: (+91) 0260-2640352 (D) 2642754**

POSSESSION NOTICE (IMMOVABLE PROPERTY)

s, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Securit nterest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under Section 13(12 read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued deman notices <mark>dated 29-06-2024</mark> calling upon the Borrowers / Guarantor / Mortgagor, **M/s, M M** Corporation (Borrower), Mr. Mahendra Birdhichand Golchha (Proprietor) and Mrs Manjudevi Mahendra Golchha (Guarantor) to repay the amount mentioned in the notice peing Rs.24,59,787.46/- (Twenty Four Lacs Fifty Nine Thousand Seven Hundred Eighty Seven Rupees and Forty Six Paisa only) + unapplied Interest + Other charges as on 28.06.2024 and interest thereon notice dated 29-06-2024 within 60 days from the

date of receipt of the said notice. The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken possession of the properties described herein below in exercise of powers conferred or nim/her under Sub- Section (4) Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the **02nd day of September**

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of the Bank of Baroda, Silvassa Branch, Silvassa for an amount of being Rs. 24.59.787.46/-(Twenty Four Lacs Fifty Nine Thousand Seven Hundred Eighty Seven Rupees and Forty Six Paisa only) + unapplied Interest + Other charges as on 28-06-2024 and further interest & expenses thereon until the full payment

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act respect of time available, to redeem the secured assets

Description of the Immovable Properties

All that piece and parcel of constructed immovable property ,being the Residential Flat No.403.bearing Municipal House No.15/13/A/403, admeasuring 1163 Sg Feets i.e.108.04 Sq Meters) Super Builtup area lying and located on the 4th Floor of the building known as "EMMANUEL COMPLEX" Constructed over the properties bearing Survey Nos.604/10 and 604/11, totally admeasuring area 747 Sq Meters. Situated a above MRF Type Showroom, Khariwad Nani Daman within Daman Municipal Corporation area within Registration Sub-District Daman, District Daman and the property is in the name of Mrs. Manjudevi Mahendra Golchha and the property is bounded as follows:- East:-Open to Sky, West:-Flat No.15/13/A/4F-1, North:-Stare case & flat No.15/13/A/4F-2, **South** :- Open to Sky.

Sd/- Assistant General Manager & Authorised Office Date: 02.09.2024 Place: Silvassa Bank of Baroda, Adivasi Bhava

GAUTAM GEMS LIMITED

Regd Officee: 3rd Floor, Office: 301, Sumukh Super Compound, Vasta Devadi Road, Surat - 395004 || Website: www.gautamgems.com || Contact: 0261-2538046 || Email: complianceggl@gmail.com || CIN NO: L36911GJ2014PLC078802

NOTICE OF 11TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 11th Annual General Meeting (AGM) of the Members of Gautam Gems Limited is scheduled to be held on Monday, 30th September, 2024 at 12:00 PM through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM) to transact the business as set out in the Notice of the 11th AGM, which is being circulated for convening the AGM. The Company has already dispatched the Annual Report for the Financial Year 2023-24 along with the Notice convening 11th AGM through electronic mode to the Shareholders whose perils address are registered with the Company and / or node to the Shareholders whose email address are registered with the Company and / c Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affair and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice o 11th AGM also available on the website of the company at www.gaulamgems.com and o the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com As Per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companie Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligation (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2") issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share of the Company as on Monday, September 23, 2024 (the "cut-off date"), The details are required pursuant to the provision of the Company and Advanced the Adv panies Act. 2013 and rules made thereunder are given below

The Book closure period shall commence on 24th September, 2024 and end of the September, 2024 (both days inclusive);

2) The remote e-voting period will commence at 09:00 a.m. on Friday, September 27 2024 and will end at 05:00 p.m. on Sunday, September 29, 2024.

Cut-off date for determining rights of entitlement of e-voting is Monday, September

The members will not be allowed to vote through remote e-voting beyond the perio

specified above:

5) Shareholder acquiring the share of the company and becomes the members of the company after sending of the Notice and holding Shares as of the cut-off date may ollow steps mention in the Notice of AGM to exercise their voting rights; 5) The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM but shall not be entitled to cast their vote again.
7) The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company

Secretary to act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who sha submit the results of voting to the Chairman.) In case of any queries / grievances pertaining to remote e-voting you may refer t ie Frequently Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manua

or Shareholders available at www.evoting.nsdl.com under help section or contact a 022-23058542/43 For Gautam Gems Limited Date: 06/09/2024 sd/- Gautam Pravinchandra Sheth















Place : Surat



Managing Director- DIN: 06748854

